

RAN-2308000601060013

F.Y.B.Com. (NEP) (Semester-I) Examination April - 2026

Tax Procedure and Practice Paper-I

(Skill Enhancement Course - Total Credit-2)

Time: 1 Hour]

[Total Marks: 25

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: <table border="1"> <tr> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> </tr> </table> Student's Signature						

પ્ર-1. ટૂંકા પ્રશ્નો (7 માંથી કોઈપણ ૬ જવાબ આપો)

10

- 1) કર ની વ્યાખ્યા આપો.
- 2) પરોક્ષ કર ના ઉદાહરણો આપો.
- 3) સંપૂર્ણ ફોર્મ આપો GST, CBDT.
- 4) આવકવેરા વસૂલવાના મૂળભૂત સિદ્ધાંતો જણાવો.
- 5) કર ના નવા માળખાં મુજબ મૂળભૂત મુક્તિ મર્યાદા શું છે જે કર માટે વસૂલવાપાત્ર નથી?
- 6) GST હેઠળ સમાવિષ્ટ કરાયેલા કોઈપણ ચાર પરોક્ષ કરની યાદી બનાવો.
- 7) ઈનપુટ ટેક્સ ક્રેડિટ શું છે?

પ્ર-2. કરચોરી અને કર આયોજન પદ સમજાવો અને કરચોરી અને કર આયોજન વચ્ચેનો તફાવત જણાવો.

15

અથવા

પ્ર-2. 1) ભારતમાં આવકવેરા કાયદાના સ્રોતો સમજાવો.

07

- 2) M/s X તેના વ્યવસાયની વિગતો આપી રહી છે જેમાં નીચેના વ્યવહારોનો સમાવેશ થાય છે. ધારો કે ઈનપુટ ટેક્સ ક્રેડિટ નથી. ? ની જગ્યાએ ખૂટતી વિગતની ગણતરી કરો.

08

ક્રમ નં.	ગંતવ્યથી	ગંતવ્ય સુધી	કિંમત	GST દર %	IGST	CGST	SGST
1)	વાપી	જયપુર	50,000	5	?	?	-
2)	રાજકોટ	વલસાડ	?	12	-	24,000	?
3)	સુરત	દિલ્લી	1,00,000	18	?	?	?
4)	મુંબઈ	ગોવા	2,00,000	5	?	-	?

ENGLISH VERSION

Q-1. Short Questions. (Answer any 5 out of 7) 10

- 1) Define Tax
- 2) Give the examples of indirect Tax
- 3) Give Full form: GST, CBDT
- 4) State the basic principles of charging Income Tax.
- 5) What is the basic exemption limit which is not chargeable to tax as per New Regime?
- 6) List any four indirect taxes which has been subsumed under GST.
- 7) What is Input Tax Credit?

Q-2. Explain the Term Tax Evasion and Tax Planning and give difference between Tax Evasion and Tax planning 15

OR

Q-2. Write the following answer:

- 1) Explain the Sources of Income tax Law in India.
- 2) M/s X is sharing his business details which includes the following transactions. **07**
Assume no input tax credit Calculate the missing (?) figures. **08**

Sr. No.	From Destination	To Destination	Price	GST Rate %	IGST	CGST	SGST
1)	Vapi	Jaipur	50,000	5	?	?	-
2)	Rajkot	Valsad	?	12	-	24,000	?
3)	Surat	Delhi	1,00,000	18	?	?	?
4)	Mumbai	Goa	2,00,000	5	?	-	?